

Seat No. : \_\_\_\_\_

# AF-103

April-2016

B.Sc., Sem.-VI

## Elective – 311 : Chemistry (Nanomaterials and Nanotechnology)

Time : 3 Hours]

[Max. Marks : 70

- સ્વીચ્છના : (1) દરેક પ્રેશનના ગુણ સરખા છે.  
(2) જમણી બાજુના આંકડાઓ ગુણ દર્શાવે છે.

1. (a) નેનોકષ્ટો (particles)ના ચુંબકીય ગુણધર્મો પર ટૂંકનોંધ લખો. 7

અથવા

ધ્યાત્વિક નેનોકષ્ટો બનાવવા માટેની દ્રાવક ઘટક રિઝક્શન પદ્ધતિનું વર્ણન કરો.

- (b) અકાર્બનિક આણુનો ઉપયોગ કરીને નેનોકષ્ટોની સ્વ-ગોઠવણી વિશે ચર્ચા કરો. 7

અથવા

નેનો મટીરીયલ્સ માટે સોલ-જેલ પદ્ધતિ પર ટૂંકનોંધ લખો.

2. (a) ગ્રેફિન (Graphene) પર નોંધ લખો. 7

અથવા

ફુલેરીન્સ (fullerenes)ના શુદ્ધિકરણ પર ટૂંકનોંધ લખો.

- (b) નેનો ફાઇબર્સ (nanofibers) એટલે શું ? તેની ઉપયોગિતા સમજાવો. 7

અથવા

પદો સમજાવો :

- (i) ક્વોન્ટમ વેલ્સ (Quantum wells)  
(ii) ક્વોન્ટમ વાયર્સ (Quantum wires)

3. (a) પ્રકાશીય માઈક્રોસ્કોપ (optical microscope)નું આકૃતિસહ વર્ણન કરો. 7

અથવા

ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઈક્રોસ્કોપનું આકૃતિસહ વર્ણન કરો.

(b) રાસાયણિક પૃથ્વીકરણ પદ્ધતિ માટે ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રોસ્કોપીનું મહત્વ જણાવો.

7

**અથવા**

ક્ષ-કિરણ વિવર્તન એટલે શું ? નેનોકણો વડે થતા વિવર્તનને સમજાવો.

4. (a) ઇલેક્ટ્રોનિક્સમાં નેનોટેકનોલોજીના ઉપયોગો જણાવો.

7

**અથવા**

બાયોટેકનોલોજી અને તબીબી ક્ષેત્રે નેનોટેકનોલોજીના ઉપયોગો લખો.

(b) વિશિષ્ટ બંધારણવાળા પોલિમર્સ (polymers) પર ટૂંકનોંધ લખો.

7

**અથવા**

સોલાર એનર્જી ક્ષેત્રે નેનોમટીરીયલ્સનું મહત્વ સમજાવો.

5. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો :

14

- (1) સ્પટરીંગ (sputtering) એટલે શું ?
- (2) લેસર બાધીભવનનો એક ઉપયોગ લખો.
- (3) નેનોટેકનોલોજીની વાખ્યા આપો.
- (4) કાર્બન નેનોટ્યુબમાં કાર્બન સિવાય બીજું કયું મટીરીયલ્સ વપરાય છે ?
- (5) MWCNTsનું પુરું નામ લખો.
- (6) હેલિકલ CNT માટે કોણ ઠ અને કિરાલીટીનું મૂલ્ય લખો.
- (7) અગર (Auger) ઇલેક્ટ્રોનની શોધ ક્યા વૈજ્ઞાનિકે અને ક્યારે કરી હતી ?
- (8) SEMનું પુરું નામ લખો.
- (9) કોન્ફોકલ માઈક્રોસ્કોપનો સિદ્ધાંત શું છે ?
- (10) સોલાર એનર્જી મેળવવા માટેનો મુખ્ય સ્લોત કયો છે ?
- (11) રેફીજરેટર (Refrigerators) અને એરકન્ડિશનરમાં કઈ ધાતુનો નેનો પાર્ટીક્લ્સ વપરાય છે ?
- (12) શા. માટે સંરક્ષણ ક્ષેત્રે નેનોટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય ?
- (13) નેનોટેકનોલોજીનો પિતામહ ક્યા વૈજ્ઞાનિકને કહેવામાં આવે છે ?
- (14) કાર્બન નેનોટ્યુબનો વાસ કેટલો હોય છે ?

\_\_\_\_\_

Seat No. : \_\_\_\_\_

## **AF-103**

**April-2016**

**B.Sc., Sem.-VI**

### **Elective – 311 : Chemistry (Nanomaterials and Nanotechnology)**

**Time : 3 Hours]**

**[Max. Marks : 70**

**Instructions :** (1) All questions carry equal marks.

(2) Figures to the right indicate marks.

1. (a) Write a short note on magnetic properties of nano particles. 7

**OR**

Explain the solution phase reduction process to make metal nano particles.

- (b) Discuss self Assembly of nano particles using inorganic molecules. 7

**OR**

Write a short note on Sol - Gel method for nanomaterials.

2. (a) Write a note on Graphene. 7

**OR**

Write a short note on the purification of fullerenes.

- (b) What are nanofibers ? Explain its application. 7

**OR**

Explain the terms :

- (i) Quantum wells  
(ii) Quantum wires

3. (a) Describe optical microscope with diagram. 7

**OR**

Explain transmission electron microscope with diagram.

- (b) Describe importance of electron spectroscopy for chemical analysis technique. 7

**OR**

What is X-ray diffraction ? Explain diffraction from nanoparticles.

4. (a) Describe the application of nano technology in Electronics.

7

**OR**

Write the application of nano technology in biotechnology field and medical field.

(b) Write a short note on special architecture polymers.

7

**OR**

Write the importance of nano materials in the field of solar energy.

5. Answer the following question in shorts.

14

- (1) What is sputtering ?
  - (2) Write one use of Laser vaporization.
  - (3) Give defination of nanotechnology.
  - (4) Which materials use in carbon nanotube except carbon ?
  - (5) Write the full form of MWCNTs.
  - (6) Give value of angle  $\theta$  and chirality for Helical CNT.
  - (7) Who has invented Augar electron and When ?
  - (8) Write the full form of SEM.
  - (9) Describe the principle of Confocal microscope.
  - (10) Which is the main source to get solar energy ?
  - (11) Which metal's nano particles are used in refrigerators and air conditioners ?
  - (12) Why can be used nano technology in defense field ?
  - (13) Who is called the 'Father of nano technology' ?
  - (14) What is the diameter of carbon nanotube ?
-